

Seat No. : \_\_\_\_\_

**MU-102**

December-2016

**M.Com., Sem.-I**

**404 : Business Research Method  
(New Syllabus)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70]**

- ભૂયા :**
- (1) જમણી બાજુ લખેલ આંકડા ગુણ દર્શાવે છે.
  - (2) કેલક્યુલેટર વાપરી રકાય છે.
  - (3) આંકડાશાસ્ત્રીય કોષ્ટકની કિંમત પ્રસ્તુત રીતે જ આપેલી છે.

1. (a) મૂળભૂત સંશોધન અને વ્યાવહારિક સંશોધનની વાયા લખી, તેની લાખણિકતાઓ તથા મર્યાદાઓ જણાવો. 7

**અધ્યવા**

સંશોધન પોજના એટલે શું ? તેના પ્રકારો અને હેતુઓ વર્ણિવો.

- (b) ગમે તે બેના જવાબ લખો :
- (1) સંશોધન શીર્ષક અને સંશોધન અવ્યાસના હેતુઓનું મૂલ્યાંકન કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તે જણાવો.
  - (2) સંશોધન અહેવાલ લેખન વિશે સમજૂતી આપો.
  - (3) વૈજ્ઞાનિક સંશોધન પોજનાના માપદંડો જણાવો.
- (c) ઔપચારિક અને અનઔપચારિક પ્રાયોગિક સંશોધનના પ્રકારો ટૂંકમાં સમજાવો. 3

**અધ્યવા**

પ્રાયોગિક પોજનાના મૂળભૂત સિદ્ધાંતો ટૂંકમાં સમજાવો.

2. (a) પ્રભાવલી એટલે શું ? તેના સ્વરૂપોની સમજૂતી ફાયદા-ગેરફાયદા સહિત વર્ણિવો. 7

**અધ્યવા**

બિન-સંભાવના નિર્દ્દરણના પ્રકારોના નામ લખી, સહેતુક નિર્દરણ ઉદાહરણ સહિત સમજાવી, તેની સંશોધન ઉપયોગિતા, લાભો તથા મર્યાદાઓ જણાવો.

(b) ગમે તે બેના જવાબ લખો.

4

- (1) અવલોકન અને માહિતી વચ્ચેનો તફાવત લખો.
- (2) કોષ્ટકીકરણના ઉપયોગો જણાવો.
- (3) બિન-નિર્દેશન ભુલો ટૂંકમાં સમજાવો.

(c) નીચે આપેલ આવૃત્તિ વિતરણની મદદથી સ્તંભાલેખ (Histogram) દોરો :

3

વેતન ('000 રૂમાં)	0 - 10	10 - 15	15 - 25	25 - 45	45 - 75
મજૂરો	8	10	40	32	24

અધ્યવા

ચાલીસ વિદ્યાર્થીઓની નીચે આપેલી માહિતી ઉપરથી છ વર્ગિનાઈવાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરી નીચેના જવાબો લખો:

- (1) સંચયી આવૃત્તિ વિતરણ તૈયાર કરો.
- (2) પ્રથમ વર્ગની મધ્યક્રિમત અને છેલ્લા વર્ગનું અધિઃ સીમા નિયું શોધો  
80, 88, 49, 86, 80, 75, 63, 64, 70, 64  
66, 55, 53, 93, 96, 90, 81, 77, 76, 83  
74, 71, 60, 61, 58, 67, 66, 62, 72, 78  
55, 56, 85, 91, 80, 75, 84, 75, 69, 73

3. (a) કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ કોઈ એક વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે :

7

ગુણ	આવૃત્તિ
0 - 9	3
10 - 19	5
20 - 29	3
30 - 39	4
40 - 49	17
50 - 59	25
60 - 69	22
70 - 79	8
80 - 89	6
90 - 99	7

- (1) બાઉલીનો વિષમતા ગુણાંક
- (2) ડેલીનો વિષમતા ગુણાંક
- (3) ચતુર્થક વિચલનાંક શોધો

અધ્યવા

એક કુટુંબની નીચે આપેલી ત્રિયલીપ માહિતી ઉપરથી :

- (1)  $x_3$  નું  $x_1$  અને  $x_2$  ઉપરનું નિયત સંબંધ સમીકરણ મેળવો.
- (2) જ્યારે  $x_1 = 15$  અને  $x_2 = 2.9$  હોય ત્યારે  $x_3$  ની અંદાજીત કિસ્ત મેળવો.

$x_1$	6	9	9	10	3
$x_2$	1.2	1.8	1.5	1.6	1.3
$x_3$	3	7	8	6	3

(b) ગમે તે બે ગણો :

- (1) નીચે આપેલી માહિતી પરથી હરાત્મક (Harmonic) મધ્યક શોધો :

વર્ગ	0 - 6	6 - 16	16 - 46	46 - 56	56 - 96
આવૃત્તિ	3	5	10	2	3

- (2) નીચેની માહિતી પરથી  $\sigma_{1,2,3}$  શોધો :

$$\sigma_1 = 2.9 \quad \sigma_2 = 4.2 \quad \sigma_3 = 5.1$$

$$r_{12} = 0.56 \quad r_{23} = 0.46 \quad r_{31} = 0.48$$

- (3) ક્યો રમતવીર વધુ સંગીન છે તે ચલનાંકની મદદથી ગણતરી કરી કહો. તે અંગેની માહિતી નીચે મુજબ છે:

રમતવીર	સરેરાશ પોઇન્ટ્સ	વિચરણા
A	200	36
B	160	16

(c) બહુયલીપ નિયત સંબંધ એટલે શું ? તેની ધારણાઓ લખો.

અથવા

સહસંબંધાંક એટલે શું ?  $r = \pm 1, r = 0, r = \pm 0.5$  નું અર્થધટન કરો.

4. (a) નીચે આપેલું વિતરણ ડિપ્ટી વિતરણને અનુસરે છે : ( $\chi^2$ -વિતરણની મદદથી જણાવો)

છાપની સંખ્યા	0	1	2	3	4	5	6	7	8	9
આવૃત્તિ	1	2	10	50	154	100	98	94	1	1

$$[\chi^2_{0.05} = 14.07 \text{ અને } \chi^2_{0.01} = 18.48]$$

અથવા

નીચે આપેલી માહિતી પરથી એક-માર્ગીય વિચરણનું પૃથ્વકરણ કરી તેના માટે તમારું મંત્ર્ય જરૂરી હોય :

A	36	37	39	32	36
B	34	33	33	41	31
C	41	44	38	44	48

દરેક અવલોકનોમાંથી 30 બાદ કરી coding પદ્ધતિની મદદથી ગજીતરી કરો.

$$[F_{0.01}(2, 12) = 6.93 \text{ અથવા } F_{0.01}(12, 2) = 99.42]$$

- (b) 12 દર્દીઓને એક ચોક્કસ દવા આપતા તેમના લોહીના દબાશમાં નીચે પ્રમાણે વધારો થયો છે : 4  
5, 2, 8, -1, 3, 0, -2, 1, 5, 0, 4, 6

તો તમો એમ કઈ શકો કે દવા આપવાથી લોહીના દબાશમાં વધારો થાય છે. [ $t_{0.05} = 1.80$ ]

અથવા

નીચે આપેલી માહિતી પરથી બંને સમૂહોના મધ્યકોનો તરફાવત મહત્વપૂર્ણ નથી :

સમૂહ	કર્મચારીની સંખ્યા	સરેરાશ પગ્યાર	વિચરણ
A	80	1750	144
B	120	1755	196

$$[Z_{0.05} = 1.96]$$

- (c) નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના ઉદાહરણ સહિત સમજાવો. 3

અથવા

ટૂંકનોંધ લખો : પ્રયમ પ્રકારની ભુલ અને દિતીય પ્રકારની ભુલ.

5. (a) ગઢે તે બેના જવાબ લખો :

(1) સાદચિક બ્લોક યોજનાના ગેરલાભો જરૂરી હોય.

(2) પેનલ સર્વે એટેલે શું ?

(3) નિર્ધારણ ગુણાંક ( $R^2$ ) અને એડજસ્ટેડ બધુચલીય નિર્ધારણ ગુણાંક ( $R^2_{adj.}$ ) ના સૂત્ર લખો.

- (b) નીચે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરો :
- લેટિન ચોરસ એ એવી પ્રાપોણિક યોજના છે કે જે \_\_\_\_\_ વર્ગીકરણનું સંતુલન સાંપે છે.
    - એક-માર્ગાય
    - દ્વિ-માર્ગાય
    - ન્રિ-માર્ગાય
    - એકપણ નહીં
  - \_\_\_\_\_ રીત પ્રશ્નાવલીની વિશ્વસનીયતા ચકાસવા માટે ઉપયાગી છે.
    - સ્થિરઅંક
    - સમાનતાઅંક
    - આંતરિક એકવાક્યતા-સમાંગતા
    - (a), (b) તથા (c) નશોય
  - $Z - M = ? (M - \bar{x})$ 
    - 2
    - 3
    - $\frac{2}{3}$
    - એકપણ નહીં
  - '+' વિતરણનો ઉદ્દ્દલવ વિકાસ \_\_\_\_\_ દ્વારા કરવામાં આવ્યો.
    - આર.એ. ફિશર
    - વિલિયમ ગોસેટ
    - વિલિયમ ફ્રૂક
    - એકપણ નહીં
  - નીચે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરો (ગણતરી જરૂરી છે)
    - મોસંખીના એક જથ્થામાંથી 700 મોસંખીના નિર્દર્શ યાદચિછક રીતે પસંદ કરતા 200 મોસંખી ખરાબ મળે છે. તો 95% વિશ્વસનીય સીમાઓ = \_\_\_\_\_.
      - 0.22 થી 0.34
      - 0.25 થી 0.32
      - 0.24 થી 0.33
      - એકપણ નહીં

(2) બાર વિધાથીઓ એ મેળવેલ ગુણ

58, 60, 54, 61, 66, 50, 35, 66, 64, 51, 73, 58 છે તો સરેરાશ વિચલનાંક = \_\_\_\_\_

- (a) 0.1236
- (b) 7.1666
- (c) 1.2361
- (d) એકપણ નહીં

(3) જો  $\sum(x_1 - \bar{x}_1)^2 = 24$ ,  $\sum(x_2 - \bar{x}_2)^2 = 22$ ,  $n_1 = 5$ ,  $n_2 = 7$  હોય તો  $F_{cal} =$  \_\_\_\_\_

- (a) 1.63
- (b) 1.99
- (c) 0.6117
- (d) એકપણ નહીં

Seat No. : 01875

## MU-102

December-2016

M.Com., Sem.-I

### 404 : Business Research Method (New Syllabus)

Time : 3 Hours]

[Max. Marks : 70]

- Instructions :** (1) The figures in right side indicate the marks.  
(2) Use of calculator is allowed.  
(3) Values of statistical tables are given in questions.

1. (a) Define Fundamental Research and Applied Research. State it's characteristics and limitations. 7

**OR**

What is Research Design ? Explain it's types and purposes.

- (b) Answer the questions : (any two) 4  
(1) State the important points for the evaluation of research title and research purpose of the study.  
(2) Explain about Research Report writing.  
(3) State the criteria of scientific research design.

- (c) Explain the types of formal and informal experimental design in short. 3

**OR**

Explain the basic principles of experimental design in short.

2. (a) What is Questionnaire ? Explain it's types with merit and demerits. 7

**OR**

Name the types of non-probability sampling. Explain the purposive sampling with illustration and write it's research utilities, merit and demerits also.

- (b) Answer the questions : (any two) 4  
(1) State the difference between Data and Information.  
(2) Write the uses of Tabulation.  
(3) Explain Non-Sampling Error in short.

(c) Draw the Histogram from the following frequency distribution :

3

Wages in '000 ₹	0 – 10	10 – 15	15 – 25	25 – 45	45 – 75
Workers	8	10	40	32	24

OR

The following data shows obtained marks of 40 students, prepare frequency distribution with class interval = 6, answer the following :

- (1) Prepare cumulative frequency distribution
  - (2) Determine the mid-value of initial class and lower boundary of last class.
- 80, 88, 49, 86, 80, 75, 63, 64, 70, 64  
 66, 55, 53, 93, 96, 90, 81, 77, 76, 83  
 74, 71, 60, 61, 58, 67, 66, 62, 72, 78  
 55, 56, 85, 91, 80, 75, 84, 75, 69, 73

3. (a) The marks obtained by commerce college students in any one subject are given as

7

Marks	Frequency
0 – 9	3
10 – 19	5
20 – 29	3
30 – 39	4
40 – 49	17
50 – 59	25
60 – 69	22
70 – 79	8
80 – 89	6
90 – 99	7

Find :

- (1) Bowley's co-efficient of skewness
- (2) Kelly's co-efficient of skewness
- (3) Co-efficient of Quartile Deviation

OR

The tri-variate data of a family is given below obtain :

- (1) The regression equation of  $x_3$  on  $x_1$  and  $x_2$ .
- (2) Estimate the value of  $x_3$  for  $x_1 = 15$  and  $x_2 = 2.9$

$x_1$	6	9	9	10	3
$x_2$	1.2	1.8	1.5	1.6	1.3
$x_3$	3	7	8	6	3

(b) Calculate any two :

(1) Determine Harmonic mean from the following data :

Class	0 - 6	6 - 16	16 - 46	46 - 56	56 - 96
Frequency	3	5	10	2	3

(2) Obtain  $\sigma_{12,3}$  from the following data :

$$\sigma_1 = 2.9 \quad \sigma_2 = 4.2 \quad \sigma_3 = 5.1$$

$$r_{12} = 0.56 \quad r_{23} = 0.46 \quad r_{31} = 0.48$$

(3) Determine which player is more consistent by using co-efficient of variation from the following data :

Player	Average Points	Variance
A	200	36
B	160	16

(c) What is Multiple Regression ? State it's Assumptions.

OR

What is co-relation co-efficient ? Interpret  $r = \pm 1$ ,  $r = 0$ ,  $r = \pm 0.5$ .

4. (a) Does the following distribution follows the binomial distribution ? (by using  $\chi^2$ -distribution)

No. of Heads	0	1	2	3	4	5	6	7	8	9
Frequency	1	2	10	50	154	100	98	94	1	1

$$[\chi^2_{0.05} = 14.07 \text{ and } \chi^2_{0.01} = 18.48]$$

OR

Prepare one-way ANOVA table for the following and give your comment :

A	36	37	39	32	36
B	34	33	33	41	31
C	41	44	38	44	48

Use coding method subtracting 30 from each data value.

$$[F_{0.01}(2, 12) = 6.93 \text{ or } F_{0.01}(12, 2) = 99.42]$$

(b) A certain Stimulus given to each of the 12 patients, resulted in the following increase of blood pressure.

5, 2, 8, -1, 3, 0, -2, 1, 5, 0, 4, 6

Can you conclude that the stimulus will in general be accompanied by an increase in blood pressures ?  $[t_{0.05} = 1.80]$

OR

From the following information test the hypothesis that 'there is no significant difference between two means'

Group	Number of Workers	Average Salary	Variance
A	80	1750	144
B	120	1755	196

$$[Z_{0.05} = 1.96]$$

- (c) Explain Null hypothesis and alternative hypothesis with illustration.

OR

Write a short note on : Type one error and Type two error.

5. (a) Answer any two in two or three lines :

4

(1) State the demerits of Randomized Block Design.

(2) What is Panel Survey ?

(3) State the formulas for co-efficient of determination ( $R^2$ ) and Adjusted multiple co-efficient of determination ( $R_{adj}^2$ ).

- (b) Multiple Choice Questions :

4

(1) Latin square is one of the experimental design which has a balanced \_\_\_\_\_ classification

(a) one-way (b) two-way

(c) tri-way (d) None of these

(2) \_\_\_\_\_ methods is useful for testing of reliability (authenticity) of questionnaire.

(a) Co-efficient of stability

(b) Co-efficient of equivalence

(c) Internal consistency homogeneity

(d) (a), (b) and (c) all three

(3)  $Z - M = \frac{?}{(M - \bar{x})}$

(a) 2 (b) 3

(c)  $\frac{2}{3}$  (d) None of these

(4) '+' distribution was developed by \_\_\_\_\_

(a) R.A. Fisher (b) William Gosset

(c) William Cook (d) None of these

- (c) Multiple Choice Questions (Calculation is necessary) :

(1) A random sample of 700 oranges drawn from the big lot of oranges, 200 oranges are rotten then confidence limits of 95% is \_\_\_\_\_

6

(a) 0.22 to 0.34 (b) 0.25 to 0.32

(c) 0.24 to 0.33 (d) None of these

- (2) Marks scored by 12 students are 58, 60, 54, 61, 66, 50, 35, 66, 64, 51, 73, 58 then coefficient mean deviation is \_\_\_\_\_.
- (a) 0.1236                                  (b) 7.1666  
(c) 1.2361                                    (d) None of these
- (3) If  $\sum(x_1 - \bar{x}_1)^2 = 24$ ,  $\sum(x_2 - \bar{x}_2)^2 = 22$ ,  $n_1 = 5$ ,  $n_2 = 7$  then  $F_{cal} = \frac{\text{_____}}{\text{_____}}$ .

**MU-102**

December-2016

**M.Com., Sem.-I**

**404 : Business Research Method**  
**(Old Syllabus)**

**Time : 3 Hours]****[Max. Marks : 70]**

- સૂચના :**
- (1) જમણી બાજુ લખેલ આંકડા ગુણ દર્શાવે છે.
  - (2) કેલક્યુલેટર વાપરી શકાય છે.
  - (3) આંકડાશાસ્ત્રીય કોષ્ટકની કિમત પ્રશ્નમાં જ આપેલી છે.

1. (a) મૂળભૂત સંશોધન અને વ્યાવહારિક સંશોધનની વાખ્યા લખી, તેની લાખણિકતાઓ તથા મર્યાદાઓ જણાવો. 7

**અધ્યવા**

સંશોધન યોજના એટલે શું ? તેના પ્રકારો અને ઉત્તુઓ વર્ણાવો.

- (b) ગમે તે બેના જવાબ લખો :
- (1) સંશોધન શીર્ષક અને સંશોધન અભ્યાસના હેતુઓનું મૂલ્યાંકન કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તે જણાવો.
  - (2) સંશોધન અહેવાલ લેખન વિશે સમજૂતી આપો.
  - (3) વૈજ્ઞાનિક સંશોધન યોજનાના ભાગદા જણાવો.

- (c) ઔપયોગિક અને અનુયોપયોગિક પ્રાયોગિક સંશોધનના પ્રકારો ઢૂંકમાં સમજાવો. 3

**અધ્યવા**

પ્રાયોગિક યોજનાના મૂળભૂત સિદ્ધાંતો ઢૂંકમાં સમજાવો.

2. (a) પ્રશ્નાવલી એટલે શું ? તેના સ્વરૂપોની સમજૂતી ફાયદા-ગેરફાયદા સહિત વર્ણાવો. 7

**અધ્યવા**

બિન-સંભાવના નિર્દ્દરણના પ્રકારોના નામ લખી, સહેતુક નિર્દરણ ઉદાહરણ સહિત સમજાવી તેની સંશોધન ઉપયોગિતા, લાભો તથા મર્યાદાઓ જણાવો.

(b) गमे ते बेना जवाब लघो.

- (1) अवलोकन अने माहिती वच्येनो तक्षावत लघो.
- (2) कोष्टकीकरणाना उपयोगो जडावो.
- (3) बिन-संभावना निर्दर्शन भुलो टूकमां समजावो

(c) नीचे आपेल आवृत्ति वितरणानी मददथी संभालेख (Histogram) दोरो :

वेतन ('000 ₹ मां)	0 - 10	10 - 15	15 - 25	25 - 45	45 - 75
मळूरो	8	10	40	32	24

अथवा

यालीस विधार्थीओनी नीचे आपेली माहिती उपरथी छ वर्गांत्रिमाईवाणु आवृत्ति वितरण तैयार करी नीचेना जवाबो लघो:

- (1) संख्यी आवृत्ति वितरण तैयार करो.
- (2) प्रथम वर्गानी मध्यांकिमत अने छेल्ला वर्गानु अधः सीमा घेण्य शोधो.  
80, 88, 49, 86, 80, 75, 63, 64, 70, 64  
66, 55, 53, 93, 96, 90, 81, 77, 76, 83  
74, 71, 60, 61, 58, 67, 66, 62, 72, 78  
55, 56, 85, 91, 80, 75, 84, 75, 69, 73

3. (a) नीचे आपेलु वितरण द्विपदी वितरणाने अनुसरे छ : ( $\chi^2$ -वितरणानी मददथी जडावो)

छापनी संख्या	0	1	2	3	4	5	6	7	8	9
आवृत्ति	1	2	10	50	154	100	98	94	1	1

[ $\chi^2_{0.05}$  नी कुमार 0.05 आगण 14.07 अने  $\chi^2_{0.01}$  आगण = 18.48 लो]

अथवा

नीचे आपेली माहिती परथी एक-भागीय विचरणानुं पृथकरण करी तेना माटे तमारे भंतव्य जडावो :

A	36	37	39	32	36
B	34	33	33	41	31
C	41	44	38	44	48

दरेक अवलोकनमांथी 30 बाद करी coding पद्धतिनी मददथी गणातरी करो.

[ $F_{0.01}(2, 12) = 6.93$  अथवा  $F_{0.01}(12, 2) = 99.42$  लो]

(b) गमे ते बे लघो:

- (1) नीचे आपेली माहिती परथी हरात्मक (Hormonic) मध्यक शोधो.

वर्ग	0 - 6	6 - 16	16 - 46	46 - 56	56 - 96
आवृत्ति	3	5	10	2	3

(2) નીચે આપેલી માહિતી પરથી બાઉલીનો વિષમતા ગુણાંક શોધો.

ગુણ	આવૃત્તિ
0 - 9	3
10 - 19	5
20 - 29	3
30 - 39	4
40 - 49	17
50 - 59	25
60 - 69	22
70 - 79	8
80 - 89	6
90 - 99	7

(3) નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના ઉદાહરણ સહિત સમજાવો.

(c) ટૂકનોંધ લખો : પ્રથમ પ્રકારની ભુલ અને દ્વિતીય પ્રકારની ભુલ  
અથવા

સહસરબંધાંક એટલે શું ?  $r = \pm 1, r = 0, r = \pm 0.5$  નું અર્થાંશન કરો.

3

4. (a) એક કુટંબની નીચે આપેલી ત્રિચલીય માહિતી ઉપરથી

(1)  $x_3$  નું  $x_1$  અને  $x_2$  ઉપરનું નિયતસંબંધ સમીકરણ મેળવો.

(2) જ્યારે  $x_1 = 15$  અને  $x_2 = 2.9$  ત્યારે  $x_3$  ની અંદાજાત કિભત મેળવો.

7

$x_1$	6	9	9	10	3
$x_2$	1.2	1.8	1.5	1.6	1.3
$x_3$	3	7	8	6	3

અથવા

ધાતાંકીય સરણીકરણની રીતનો ઉપયોગ કરી શરૂઆતની કિભત 200 અને સરણીકરણ આંક  
 $\alpha = 0.4$  લઈ નીચેની માહિતી માટે પૂર્વાનુમાન કરો.

t	2010	2011	2012	2013	2014	2015
$x_t$	210	220	221	225	224	222

(b) નીચેની માહિતી ઉપરથી મોસમી સુંચકાંક શોધો.

4

વર્ષ	તૈમાસ			
	$Q_1$	$Q_2$	$Q_3$	$Q_4$
2012	50	68	52	55
2013	53	60	60	50
2014	60	62	45	62
2015	62	60	53	53

અથવા

નીચે આપેલી માહિતી ઉપરથી પંચવર્ષીય ચલિત સરેરાશની રીતે વલણ શોધો.

વર્ષ	ઉત્પાદન (એકમાં)
2002	14
2003	17
2004	20
2005	18
2006	32
2007	26
2008	24
2009	27
2010	30
2011	38
2012	28
2013	30
2014	24
2015	26
2016	42

(c) સામાયિક શ્રેફ્ટિના ઘટકો સમજાવો.

3

અથવા

બહુચલીય નિયતસંબંધ એટલે શું ? તેની ધારણાઓ લખો.

5. (a) ગમે તે ભેના જવાબ લખો :

4

(1) યાદચિછક બ્લોક પોજનાના ગેર-લાભો જીવાવો.

(2) પેનલ સર્વે એટલે શું ?

(3) નિર્ધરણ ગુણાંક ( $R^2$ ) અને એડજસ્ટેડ બહુચલીય નિર્ધરણ ગુણાંક ( $R_{adj}^2$ ) ના સૂત્ર લખો.

(b) નીચે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરો :

4

(1) હેટિન ચોરસ એ એવી પ્રાયોગિક પોજના છે કે જે \_\_\_\_\_ વર્ગાકરણનું સંતુલન સાંથે છે.

(a) એક-માર્ગીય

(b) દ્વિ-માર્ગીય

(c) ત્રિ-માર્ગીય

(d) એકપણ નહીં

(2) \_\_\_\_\_ પ્રણાવલીની વિશ્વસનીયતા ચકાસવા માટે ઉપયોગી છે.

(a) સિથરાંક

(b) સમાનતાંક

(c) આંતરેક-એકવક્ષયતા સમાંગતા

(d) (a), (b) તથા (c) ત્રણેય

(3)  $Z - M = ?$  ( $M - \bar{x}$ )

(a) 2 (b) 3

(c)  $\frac{2}{3}$  (d) એકપણ નહીં

(4)  $b_{12,3} = ?$

(a)  $\left[ \frac{\sigma_1}{\sigma_2} \right] \left[ \frac{r_{12} - r_{31} r_{23}}{1 - r_{23}^2} \right]$  (b)  $\left[ \frac{\sigma_2}{\sigma_1} \right] \left[ \frac{r_{12} - r_{31} r_{23}}{1 - r_{23}^2} \right]$

(c)  $\left[ \frac{\sigma_1}{\sigma_3} \right] \left[ \frac{r_{23} - r_{12} r_{31}}{1 - r_{23}^2} \right]$  (d) એકપણ નહીં

(c) નીચે આપેલા વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરો (ગણતરી જરૂરી છે.)

6

(1) જો  $\mu_1 = 0, \mu_2 = 6.8, \mu_3 = -7.2$  અને  $\mu_4 = 74$  હોય તો  $\beta_1 = ?$  અને  $\beta_2 = ?$

(a) 0.17, 1.6 (b) 0.41, 0.62  
(c) 0.24, 1.9 (d) એકપણ નહીં

(2) બાર વિધાધીઓમે મેળવેલ ગુણ

58, 60, 54, 61, 66, 50, 35, 66, 64, 51, 73 અને 58 છે તો સરેરાશ વિચલનાંક = ?

(a) 0.1236 (b) 7.1666  
(c) 1.2361 (d) એકપણ નહીં

(3) જો  $\sum(x_1 - \bar{x}_1)^2 = 24, \sum(x_2 - \bar{x}_2)^2 = 22, n_1 = 5$  અને  $n_2 = 7$  હોય તો  $F_{cal} = ?$

(a) 1.63 (b) 1.99  
(c) 0.6117 (d) એકપણ નહીં

Seat No. : \_\_\_\_\_

**MU-102**

December-2016

**M.Com., Sem.-I**

**404 : Business Research Method (Old)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70]**

- Instructions :** (1) The figures in right side indicate the marks.  
(2) Use of calculator is allowed.  
(3) Values of statistical tables are given in questions.

1. (a) Define Fundamental Research and Applied Research. State its characteristics and limitations. 7

**OR**

What is Research Design ? Explain it's types and purposes.

- (b) Answer the questions : (any two) 4
- (1) State the important points for the evaluation of research title and research purpose of the study.  
(2) Explain about Research Report writing.  
(3) State the criteria of scientific research design.
- (c) Explain the types of formal and informal experimental design in short. 3

**OR**

Explain the basic principles of experimental design in short.

2. (a) What is Questionnaire ? Explain its types with merit and demerits. 7

**OR**

Name the types of non-probability sampling. Explain the purposive sampling with illustration and write it's research utilities, merit and demerits also. 4

- (b) Answer the questions : (any two)
- (1) State the difference between Data and Information.  
(2) Write the uses of tabulation.  
(3) Explain Non-Sampling error in short.

- (c) Draw the Histogram from the following frequency distribution :

3

Wages in '000 ₹	0 – 10	10 – 15	15 – 25	25 – 45	45 – 75
Workers	8	10	40	32	24

OR

The following data gives the obtained marks of 40 students, prepare frequency distribution with class interval = 6, answer the following :

- (1) Prepare cumulative frequency distribution
  - (2) Determine the mid-value of initial class and lower boundary of last class.
- 80, 88, 49, 86, 80, 75, 63, 64, 70, 64  
 66, 55, 53, 93, 96, 90, 81, 77, 76, 83  
 74, 71, 60, 61, 58, 67, 66, 62, 72, 78  
 55, 56, 85, 91, 80, 75, 84, 75, 69, 73

3. (a) Does the following distribution follows the binomial distribution ?

(by using  $\chi^2$ -distribution)

7

No. of Heads	0	1	2	3	4	5	6	7	8	9
Frequency	1	2	10	50	154	100	98	94	1	1

$$[\chi^2_{0.05} = 14.07 \text{ and } \chi^2_{0.01} = 18.48]$$

OR

Prepare one-way ANOVA table for the following and give your comment :

A	36	37	39	32	36
B	34	33	33	41	31
C	41	44	38	44	48

Use coding method subtracting 30 from each data value.

$$[F_{0.01}(2, 12) = 6.93 \text{ or } F_{0.01}(12, 2) = 99.42]$$

- (b) Attempt any two :

4

- (1) Determine Harmonic mean from the following data :

Class	0 – 6	6 – 16	16 – 46	46 – 56	56 – 96
Frequency	3	5	10	2	3

- (2) Obtain Bowley's co-efficient of skewness from the following data :

Marks	Frequency
0 - 9	3
10 - 19	5
20 - 29	3
30 - 39	4
40 - 49	17
50 - 59	25
60 - 69	22
70 - 79	8
80 - 89	6
90 - 99	7

- (3) Explain Null Hypothesis and alternative hypothesis with illustration.

- (c) Write a short note on type one error and type two error.

3

OR

What is co-relation co-efficient ?

Interpret  $r = \pm 1, r = 0, r = \pm 0.5$

4. (a) The tri-variate data of a family is given below : obtain (1) The regression equation of  $x_3$  on  $x_1$  and  $x_2$  (2) Estimate the value of  $x_3$  for  $x_1 = 15$  and  $x_2 = 2.9$

7

$x_1$	6	9	9	10	3
$x_2$	1.2	1.8	1.5	1.6	1.3
$x_3$	3	7	8	6	3

OR

Taking  $\alpha = 0.4$  and initial forecast = 200, determine forecasts for the following data :

t	2010	2011	2012	2013	2014	2015
$x_t$	210	220	221	225	224	222

- (b) Find seasonal indices from the following data :

4

Year	Q <sub>1</sub>	Q <sub>2</sub>	Q <sub>3</sub>	Q <sub>4</sub>
2012	50	68	52	55
2013	53	60	60	50
2014	60	62	45	62
2015	62	60	53	53

OR

Obtain trend by using five yearly moving Average from the following data :

Years	Production (in unit)
2002	14
2003	17
2004	20
2005	18
2006	32
2007	26
2008	24
2009	27
2010	30
2011	38
2012	28
2013	30
2014	24
2015	26
2016	42

(c) Explain the component of Time Series.

3

OR

What is Multiple Regression ? State its assumptions.

5. (a) Answer any two in two or three lines :

4

(1) State the demerits of Randomized Block Design.

(2) What is Panel Survey ?

(3) State the formulas for co-efficient of determination ( $R^2$ ) and Adjusted multiple co-efficient of determination ( $R_{adj}^2$ )

**(b) Multiple Choice Questions :**

- (1) Latin square is one of the experimental design which has a balanced \_\_\_\_\_ classification.
- one-way
  - two-way
  - tri-way
  - None of these
- (2) \_\_\_\_\_ method is useful for testing of reliability (authenticity) of questionnaire.
- Co-efficient of stability
  - Co-efficient of equivalence
  - Internal consistency homogeneity
  - (a), (b) and (c) all three
- (3)  $Z - M = ? (M - \bar{x})$
- 2
  - 3
  - $\frac{2}{3}$
  - None of these
- (4)  $b_{12,3} = \underline{\hspace{2cm}}$
- $\left[ \frac{\sigma_1}{\sigma_2} \right] \left[ \frac{r_{12} - r_{31} r_{23}}{1 - r_{23}^2} \right]$
  - $\left[ \frac{\sigma_2}{\sigma_1} \right] \left[ \frac{r_{12} - r_{31} r_{23}}{1 - r_{23}^2} \right]$
  - $\left[ \frac{\sigma_1}{\sigma_3} \right] \left[ \frac{r_{23} - r_{12} r_{31}}{1 - r_{23}^2} \right]$
  - None of these

(c) Multiple Choice Questions (Calculation is necessary)

6

- (1) If  $\mu_1 = 0, \mu_2 = 6.8, \mu_3 = -7.2, \mu_4 = 74$  then  $\beta_1 = \underline{\hspace{2cm}}$  and  $\beta_2 = \underline{\hspace{2cm}}$
- (a) 0.17, 1.6  
(b) 0.41, 0.62  
(c) 0.24, 1.9  
(d) None of these
- (2) Marks scored by 12 students are 58, 60, 54, 61, 66, 50, 35, 66, 64, 51, 73, 58 then coefficient mean deviation is  $\underline{\hspace{2cm}}$ .
- (a) 0.1236  
(b) 7.1666  
(c) 1.2361  
(d) None of these
- (3) If  $\sum(x_1 - \bar{x}_1)^2 = 24, \sum(x_2 - \bar{x}_2)^2 = 22, n_1 = 5, n_2 = 7$  then  $F_{col} = \underline{\hspace{2cm}}$ .
- (a) 1.63  
(b) 1.99  
(c) 0.6117  
(d) None of these